

Shree H.M.V. Arts & Commerce College - Una
 વિષય: સંચાલકીય હિસાબી પદ્ધતિ (Major)
 TY Bcom - Sem 6
 Assignment
 વર્ષ: 2025-26

Total Marks: 25

Dt: 01/01/2026

અધ્યાપક: ડી. આઈ. જી. ડીડિયા

Q1 રામ લિ. ના પાડા સરવૈયા નીચે મુજબ છે. (10 marks)

વિગ્રહ	31/3/25	31/3/24
(I) ઇકિયરી અને દેવાં:		
1) શેરભંડોળ:		
(a) શેરમૂડી:		
ઇકિયરી શેર દરેક રૂા 10 નો પૂર્ણ ભરપાઈ	7,50,000	6,00,000
10% પ્રેફ. શેર દરેક રૂા 10 નો જેના પર 38 ભરપાઈ	-	4,00,000
(2) અનામત અને વધારી:		
શેર પ્રીમિયમ	-	50,000
મૂડી અનામત	250,000	-
સામાન્ય અનામત	2,00,000	4,50,000
નફા-નફાસાળ ખાતું	2,50,000	2,00,000
2) બિનચાલુ દેવાં:		
મૂડી પરના અનામત	3,50,000	-
પ્રોવિડન્ટ ફંડ	50,000	50,000
3) ચાલુ દેવાં:		
લેણદારો	7,50,000	1,00,000
દેવીડી	3,00,000	1,95,000
કુલ	20,00,000	20,00,000
(II) મિલકતો:		
(a) કાયમી મિલકતો:		
મકાન	2,40,000	1,72,500
જમીન	1,00,000	2,00,000
પ્લાન્ટ	8,50,000	7,50,000
(b) ચાલુ મિલકતો:		
સ્ટોક	1,17,000	1,22,400
દેવાદારી	4,23,000	5,27,600

રોકડ સિલક
અગાઉથી ચૂકવેલ ખર્ચ
લેખનિહી
પરચૂરણ ખર્ચ

100000	77500
15000	12,500
30,000	17,500
125000	120000

કુલ.

20,00,000	20,00,000
-----------	-----------

વધારાની માહિતી:

1. રમીગણના વર્ષમાં સ્ટોકની કિંમત મૂળ કિંમત કરતાં 10% ઓછી આંકવામાં આવેલ હતી તે 2025 થી મૂળકિંમતે દર્શાવવાનું નક્કી કરેલ છે. તા. 31/3/25 ના રોજ સ્ટોક તેની મૂળકિંમતે દર્શાવેલ છે.
2. આલ વર્ષના શરૂઆતમાં કંપનીએ કાયદાની જરૂરી જોગવાઈઓનું પાલન કરીને પેર શેર 5% પ્રીમિયમથી પરત કરેલ છે આ માટે સામાન્ય અનામત માંથી જરૂરી રકમ મૂડી પરત અનામત ખાતે લઈ જવામાં આવી છે.
3. ઘાટવટી શેરમૂડી પર 25% લેખે ડિવિડન્ડ જાહેર કરેલ છે અને ચૂકવેલ છે.
4. વર્ષ દરમિયાન કંપનીએ પ્લાન્ટ પર રૂ. 750000 વધુ રાશી જોગવાઈ કરેલ છે. તેમજ રૂ. 250000 ની ચોપડે દર્શાવેલ કિંમતની પ્લાન્ટ રૂ. 50000 ની ખોટા વેચેલ છે.
5. જમીનની એક ટકડો વેચેલ છે જેના નફા મૂડી અનામત ખાતે જમા કરેલ છે.
6. વર્ષ દરમિયાન પરચૂરણ ખર્ચ રૂ. 25000 ચૂકવેલ છે. ઉપરોક્ત વિગતોના આધારે નમામ ગણતરીઓ સહિત રોકડ પુવાર પત્રક તૈયાર કરી.

Q2 અમિત લિ. નીચેની માહિતી પરથી લંડોન પુણે
પત્રક અને કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક તૈયાર
કરી: (10 Marks)
અમિત લિ. ના તા. ૩૧મી માર્ચના રીજના પાક સરવૈયા

વિગ્રહ	૩/૩/૨૫	૩/૩/૨૪
I. ઘડિપૂરી અને જવાબદારીઓ:		
(૧) શેરહોલ્ડરોના લંડોન:		
(અ) શેરમૂડી : દરેક રૂ 10 નો તેવાદ શેર	4000000	1000000
(બ) અનામત અને વધારી:	-	1000000
મૂડી અનામત	4000000	3000000
સામાન્ય અનામત	-	(1000000)
નફાનફસાણ ખાતું (ઉધાર બાકી)		
(2) બિનચાલુ દેવો:		
(અ) લાંબા ગાળાનાં ઉછીના નાકાં:	3000000	1000000
15% ના ડિલિવરીસ		
(બ) લાંબા ગાળાની જોગવાઈઓ:	3000000	1000000
દસારાની જોગવાઈ		
(૩) ચાલુ દેવો:		
(અ) વેપારી દેવો:	4000000	1000000
તેકાદારો	3000000	1000000
દેવાકુકી		
(બ) અન્ય ચાલુ દેવો:	-	1000000
બેંક 0.0		
(ક) ટૂંકા ગાળાની જોગવાઈઓ:	5000000	2000000
કરવૈરાની જોગવાઈ	2600000	11000000
કુલ		
II. મિલકતો:		
(1) બિનચાલુ મિલકતો:		
(અ) કાયમી મિલકતો	11,00,000	5,00,000
(બ) બિનચાલુ રોકાણો : 10% ના રોકાણો	-	1000000
(2) ચાલુ મિલકતો: સાલસામગ્રી સ્ટોક	2000000	3000000
(બ) વેપારી લેકાં: દેવાદારો	3000000	2000000
(ક) રોકડ અને રોકડ સમાન: બેંક સિલક	10,00,000	-
કુલ	26000000	11000000

પધારાણ માહિતી:

1. વર્ષના શરૂઆતમાં કંપનીએ બધી કાચમી મિલકતો રૂ. 6,00,000 માં લેવા દીધી હતી અને નફો મૂડી અનામત ખાતે જમા કર્યો હતો.
2. મૂડી અનામત માંથી કંપનીએ ઇક્વિટી શેરહોલ્ડરોને પૂરા ભરપાઈ થયેલા બોનસ શેર આપ્યા હતા.
3. વર્ષ દરમિયાન કંપનીએ રોકાણો રૂ. 1,20,000 માં લેવા દીધાં હતા.
4. વર્ષ દરમિયાન કંપનીએ રૂ. 10,00,000 વચ્ચે ગાળાના ડિવિડન્ડ જા ચૂકવ્યા હતા.
5. વર્ષ માટે રૂ. 50,00,000 ની આવકવેરાના જોગવાઈ કરી હતી.

Q.3 સીમાંત પક્ષર પદ્યગિના શાયદા અને મર્યાદાઓ સમજાવો. (5 Marks)

— શ્રી શ્રી. એમ. વી. શાસ્ત્રી અને કોમ્પાઉન્ડિંગ, ઉત્તર

Assignment પ્રશ્નો

B. Com sem-6

(કુલ ગુણ-25)

Sub: Business Accounting-6

(Composite Governance & Auditing)

(માર્ક-15)

Questions from Assignment (એમાર્પીશન પ્રશ્નો)

Q.1. ઓડિટિંગ કાર્યક્રમ, ઓડિટના પ્રકાર, ઓડિટકાર્યની તૈયારી, ઓડિટ આયોજન સમજાવો.

Q.2 આંતરિક સંકુશ અને ઓડિટની જવાબદારી વર્ણવી નિત્ય તપાસ અને પ્રાથમિક તપાસ વચ્ચેનાં તફાવત લખો.

Q.3 વાઉચરિંગ પ્રક્રિયા, વાઉચરિંગ વખતે દયામાં રાખવામાં આવેલા, વાઉચરિંગ અને ઓડિટની સંબંધ લખો.

શ્રી એચ. એમ. વી. શાહેસ્વર એન્ડ કોમર્સ કોનિજ, ઉના

Assignment પૂર્ણ

B.com sem-6

કુલ મુદ્દા-25

Sub: Business Economics-6 (Minor-6)
(Economics of Business Environment)

Questions for Assignment (એમાઈનિંગ્સ પૂર્ણ)

Q1. ભારતીય ઉદ્યોગોની વર્ગીકરણ, નાણું, મૂડી અને મધ્યમ ઉદ્યોગોના અર્થ સમજાવો અને ભારતીય ઉદ્યોગોમાં તેનો (ગુણિત) અને ઉભા વર્ણ પડકારો વિગતવાર લખો.

Q2. ભારતમાં વિદેશી પ્રતિષ્ઠા શિક્ષણો અર્થ સમજાવી સાબિતમાં પ્રવાહો અને પડકારો વર્ણવો

Q3. નિર્ણય આયોગોના ઉદ્દેશો અને મુખ્ય કાર્યો સ્પષ્ટતામાં સમજાવો.

SHRI H.M.V ARTS & COMMERCE COLLEGE, UNA

STREAM: Commerce SEM: 6

SUBJECT: A.E.C (English) (Business Research Method)

- 1 Explain 7 types of objectives of Research Methodology
- 2 Write a note on Research report (explain in detail)
- 3 What precautions are to be taken while writing report?

સા. ગાંધી યુનિવર્સિટી ગાંધીધામ સમીક્ષા
કોમર્સ કોલેજ, ભિના
ASSIGNMENTS FOR INTERNAL
MARKS (2025-26)

Pg.No:
Date: 1 / 120

B.COM. SEM - 6 (NEP) 2025-26

વિષય: CORPORATE ACCOUNTING - 2 (MAJOR 16)

અધ્યાપકશ્રીનામ: એ.પી. મોરજી રિય,

ASSIGNMENTS ના કુલ ગુણ: 25

પ્રશ્ન: આર્થિક સિ. અને પ્રકાશ સિ.ના તા. 31/3/2025 ના રોજ
ના પાછા ચાલેલા નીચે મુજબ છે.

વિગત	આર્થિક સિ. રૂ.	પ્રકાશ સિ. રૂ.
I <u>દરિયાની અને દેવાં:</u>		
<u>શોરમૂકી</u> : દરેક રૂ. 100 નો એક એવા દરિયાની શોર	5,00,000	1,00,000
<u>અનામત અને વધારો:</u>		
સામાન્ય અનામત	1,50,000	-
જાડા ગુરુત્વાળા પાણી	57,500	18000
<u>વિનવાલુ દેવાં</u>		
બેંક દેવાં	32,500	7750
દેવાંદારી	5,000	-
કુલ	7,45,000	1,20,750
II <u>ગિલાકલો</u>: <u>વિનવાલુ મિલકતો</u>:		
પાણી	-	17,500
જમીન મકાન	1,75,000	50,000
મશીનરી	3,50,000	-
ફર્નિચર	25,000	-
પેટન્ટ	37,500	2,500
પાણી	-	7,500
<u>માલુ ગિલાકલો</u> :		
રેકોર્ડ	75,000	16,000
દેવાંદારી	25,000	15,500
બેંકદારી	7,500	-
બેંક	50,000	11,750
કુલ	7,45,000	1,20,750

(1) બંને કંપનીના ડિરેક્ટરોએ રોકડ સિવાયના મિલકતો
અને દેવાં પરીક્ષા કરીને જાણ કરવાની વિચારણા સિ. ના
સહાયતા કરવાનું નક્કી કર્યું.

(2) વિચારણા સિ. ના સહાયતા શોરમૂકી રૂ. 10 નો એક
એવા 600000 દરિયાની શોરની નક્કી કરવા માં
સહાય.

- (3) આનંદ રા. ની ખરીદકિંમત રૂ. 700000 પેટે 44300 ઇકિવટી શોર દરેક રૂ. 10 નો 50% પ્રીમિયમ અને બાકીની રકમ રોકડમાં મૂકવા.
- (4) પ્રકાશ રા. ની ખરીદકિંમત રૂ. 92500 પેટે 5700 ઇકિવટી શોર દરેક રૂ. 10 નો 50% પ્રીમિયમ અને બાકીની રકમ રોકડમાં મૂકવામાં આવે.
- (5) ચિરાગ રામિટેડે બાકીના શોર પૈકી 200000 ઇકિવટી શોર નહેરજનલા ને રૂ. 10 ની મૂલકિંમત ના 50% પ્રીમિયમના બહાર પાડ્યા જે પૂરા ભરપાઈ થયા નેવાર કરો:

- (1) આનંદ રા. ના ઓપરે જરૂરી ખાતા - 10 Marks
(2) પ્રકાશ રા. ના ઓપરે જરૂરી ખાતા - 10 Marks
(3) ચિરાગ રા. ના ઓપરે આમનોંદ - 5 Marks

— x — x —

એકાદશમેસ્ટ આપવાની તારીખ અને સમય

તારીખ: 24/01/2026 શનિવાર

સમય: 8 થી 9 સવારે

B.COM. 6 ના વર્ગમાં

રૂમ નં. 20

સૂચના:

- એકાદશમેસ્ટ ના પ્રથમ પાના પર પ્રુક્ટનામ, વર્ગ, રોલ નંબર, વિષયનું નામ, મોબાઇલ નંબર દર્શાવવા
- એકાદશમેસ્ટ આપવા ફરજિયાત છે અને તે INTERNAL MARKS નો એક ભાગ છે
- એકાદશમેસ્ટ ગિયત તારીખે અને સમયે અચૂક આપા જવા
- INTERNAL TEST ની તારીખ રહે પછી નહેર થશે